



Date: 15.05.2025
PFSPL/2025-26/BSE/24

To,
BSE Limited,
1st Floor, P.J Towers,
Dalal Street,
Mumbai – 40001.

Dear Sir/Ma'am,


Sub: Intimation for Publishing Financial Results in the Newspaper in compliance of Regulation 52(8) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

In pursuance of Regulation 52(8) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 the Company in its Meeting of Board of Directors held on Tuesday, 13th May 2025 has approved the Audited Financial results for the quarter and year ended 31st March 2025 and the Company has also Published its Standalone Audited Financial Results in Regional and English national daily newspapers on Wednesday, 14th May 2025.

This is for your information and records.

Thanking You,
Yours Faithfully,

For, Pahal Financial Services Private Limited


Dimple Padhiar
Company Secretary
Mem. No. A39930



Date: May 15, 2025
Place: Ahmedabad

PAHAL FINANCIAL SERVICES PVT. LTD
CIN NO. : U65910GJ1994PTC082668

☎ 02717-479169

🌐 www.pahalfinance.com

✉ ho@pahalfinance.com

📍 Regd. Office : 7th Floor Binori B Square-2, Opp. Hathising Ni Vadi, Ambli-Iskcon Road, Ahmedabad (Gujarat) - 380054

MOVE COMES AFTER 'SPECIFIC REQUEST' BY MEA

Jaishankar's security to be enhanced

Security for foreign secy to be also reviewed

MAHENDER SINGH MANRAL
New Delhi, May 13

THE DELHI POLICE has started the process of increasing security cover for External Affairs Minister S Jaishankar following a "specific request" from the Ministry of External Affairs over the weekend — after military hostilities between India and Pakistan along the border had peaked following the Pahalgam terror attack, it has been learnt.

The police are also reviewing their security cover for foreign Secretary Vikram Misri, and at least 25 leaders from BJP, including Union Ministers, MPs and Delhi Chief Minister Rekha Gupta. This decision was taken during a meeting held by Delhi Police Commissioner Sanjay Arora with all senior officers Sunday on security for VIPs who spoke



out publicly against Pakistan on social media amid the military confrontation. It was also decided to provide firing and medical emergency training for all security personnel involved, sources said.

In the case of Jaishankar, sources said, the police have urged the Union Home Minister to conduct a threat assessment.

The measures being considered include increasing the number of spotters outside the Union Minister's residence

and office, an escort car and a new call sign for him.

"He has 2 category security cover of the CRPF, which has his gunmen for mobile security, and ten more for residence security. Earlier, there was Z plus, which has 10 security personnel for mobile security and ten others for residence security," a senior officer said.

Home Ministry guidelines regarding security arrangements for VIPs and VVIPs do not currently have provision for an escort car and a specific call sign.

"On Sunday, the MEA had sent a letter to a senior police officer at PHQ and they have now sent it to the MHA, asking to take a decision after conducting a fresh threat assessment," the sources said.

Referring to the meeting at the police HQ, sources said, "Following the directions of a special CP, a list of about 25 VIPs, all belonging to the BJP, and Foreign Secretary Vikram Misri, was prepared."

CBSE results: Dip in number of students with over 90% score

PRESS TRUST OF INDIA
New Delhi, May 13

GIRLS CONTINUED to outshine boys in CBSE board exams for classes 10 and 12, while the number of candidates scoring above 90% in both classes recorded a dip, according to Examination Controller Sanyam Bhardwaj.

The pass percentage in both classes witnessed a marginal increase.

The Central Board of Sec-

ondary Education (CBSE) board exam results for the two classes were announced on Monday. In class 10, the pass percentage of candidates cleared the exam, a marginal rise from last year's 87.98%. The pass percentage in class 10 stood at 93.66, marginally up from last year's 93.60%.

Girls edged past boys in class 12 by a margin of 5.94 percentage points, while the margin in class 10 pass percentage stood at 2.37.

Transgender's pass percentage was 100 in class 12 as against previous year's 50. In class 10, the pass percentage of transgender was 95 against last year's 91.30. The board, however, did not divulge the number of transgender candidates who appeared for the exam in both classes.

CBSE officials attributed the rise in pass percentage to an increase in the number of competency-based questions this year.

Head Office: Lokmangal, 1501, Shivajinagar, Pune - 411 005
Ph: 020-25511360
E-mail: investor_services@mahabank.co.in
Website: www.bankofmaharashtra.in

Notice to Shareholders of Bank

This is to inform that with a view to fill in the vacancy of One Shareholder Director because of increase in paid-up equity share capital as mentioned in Banking Companies (Acquisition & Transfer of Undertakings) Act, 1970, Bank will conduct election of One Shareholder Director.

In view of the above, Bank has fixed **Friday, 23rd May, 2025** as the **Specified Date** for the purpose of ascertaining the Shareholders of Bank eligible to participate i.e. "to Nominate, Contest and Vote" in the election process of One Director of Bank of Maharashtra to be elected by the Shareholders other than the Central Government, from among themselves, in terms of Section 9(3)(i) of the Banking Companies (Acquisition and Transfer of Undertakings) Act, 1970, read with the Banking Regulation Act, 1949, The Nationalised Banks (Management and Miscellaneous Provisions) Scheme, 1970, The Bank of Maharashtra (Shares & Meetings) Regulations, 2004 as amended from time to time. Notifications of Reserve Bank of India and Government of India and SEBI (LODR) Regulations, 2015 at the ensuing Annual General Meeting.

Last date for submission of nomination forms is **on or before 5.00 pm on Tuesday, 10th June, 2025.**

Date: 14.05.2025 (Vishal Sethia)
Place: Pune Company Secretary & Board Secretary

Pahal Financial Services Private Limited

Regd. Office: 10th Floor, Room B Square 2 Opp. Hathings road, Ambli local Road Amblihad 400054
Ph: 022-17479399 Local - 10000000000 Website: www.pahalfinancial.com

Form for publishing financial results in newspapers
(Regulation 52, read with Regulation 52 of the SEBI (Listing and Other Disclosures Requirements) Regulations, 2015 (LODR Regulations))

Sl. No.	Particulars	Quarter ended 31.03.2025	Quarter ended 31.03.2024	Preceding quarter ended 31.03.2024	Year ended 31.03.2024
1.	Total Income from Operations	1,03,75,13	13,89,11	13,75,15	54,43,12
2.	Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
3.	Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
4.	Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
5.	Total Comprehensive Income for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	1,03,75,13	13,89,11	13,75,15	54,43,12
6.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
7.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
8.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
9.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
10.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
11.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
12.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
13.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
14.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
15.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
16.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
17.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
18.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
19.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
20.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
21.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
22.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
23.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
24.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
25.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
26.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
27.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
28.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
29.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
30.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
31.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
32.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
33.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
34.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
35.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
36.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
37.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
38.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
39.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
40.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
41.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
42.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
43.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
44.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
45.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
46.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
47.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
48.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
49.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
50.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
51.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
52.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
53.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
54.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
55.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
56.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
57.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
58.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
59.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
60.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
61.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
62.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
63.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
64.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
65.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
66.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
67.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
68.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
69.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
70.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
71.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
72.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
73.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
74.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
75.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
76.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
77.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
78.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
79.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
80.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
81.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
82.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
83.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
84.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
85.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
86.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
87.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
88.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
89.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
90.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
91.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
92.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
93.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
94.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
95.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
96.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
97.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
98.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
99.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18
100.	Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	99,13	1,41,10	(94,10)	40,18,18

BONANZA PORTFOLIO LIMITED

Bonanza House, Plot No. M-2, Cama Industrial Estate, Waihat Road, Behind The Hub, Goregaon East, Mumbai - 400 063
Contact Number: +91 22 68379791 11 40749709
Email Address: swati.agrawal@bonanzacorp.com, abhay.bansal@bonanzacorp.com
Contact Person: Ms. Swati Agrawal / Mr. Abhay Bansal
SEBI Registration Number: NN000012306
Validity: Permanent

For and on behalf of Acquirer:
Sd/-
Mr. Deepak Babul Khawad (Acquirer)

Date: Saturday, May 17, 2025
Place: Mumbai

NIIT

NIIT Limited

Regd Office: Plot No. 85, Sector - 32, Institutional Area, Gurugram - 122001 (Haryana) India
Tel: +91 (124) 4293000 Fax: +91 (124) 4293333 Website: www.niit.com | investors@niit.com
Corporate Identity Number: L74899HR1981PLC107123

Extract of Audited Financial Results for the quarter and year ended March 31, 2025

(Rs. in Millions, except per share data)

S. No.	Particulars	Consolidated					Standalone				
		Quarter ended			Year ended		Quarter ended			Year ended	
		3 Months ended March 31, 2025	Preceding 3 months ended March 31, 2024	Corresponding 3 months ended March 31, 2024	Current year ended March 31, 2025	Previous year ended March 31, 2024	3 Months ended March 31, 2025	Preceding 3 months ended March 31, 2024	Corresponding 3 months ended March 31, 2024	Current year ended March 31, 2025	Previous year ended March 31, 2024
		Audited	Unaudited	Audited	Audited	Audited (Refer note 4)	Audited	Unaudited	Audited	Audited	Audited (Refer note 4)
1	Total Income from Operations	862.85	981.11	743.44	3,575.83	3,034.72	284.99	317.34	300.56	1,259.52	1,298.19
2	Net Profit for the quarter/ year (before Tax, Exceptional and/or Extraordinary items)	168.35	173.71	128.77	591.64	462.02	194.69	34.44	97.67	383.33	370.93
3	Net Profit for the quarter/ year before tax (after Exceptional and/or Extraordinary items)	165.85	173.71	128.77	589.14	459.11	192.19	34.44	97.67	380.83	368.02
4	Net Profit for the quarter/ year after tax (after Exceptional and/or Extraordinary items) (before discontinued operations)	137.73	140.79	114.77	495.13	399.14	190.85	32.74	93.58	375.86	351.56
5	Loss after tax from discontinued operations	(0.76)	(0.96)	(0.86)	(14.87)	(4.18)	(0.76)	(0.96)	(0.86)	(14.87)	(4.18)
6	Net Profit for the quarter/ year after tax (after Exceptional and/or Extraordinary items)	136.97	139.83	113.91	480.16	394.96	190.09	31.78	92.72	360.89	347.38
7	Total Comprehensive Income for the quarter/ year (Comprising Profit for the quarter/ year (after tax) and other Comprehensive Income (after tax))	135.06	135.84	108.27	487.16	381.93	185.96	33.69	93.79	361.54	351.34
8	Paid-up equity share capital (face value of Rs. 2 each, fully paid)	271.19	271.03	270.14	271.19	270.14	271.19	271.03	270.14	271.19	270.14
9	Reserves excluding revaluation reserves				10,517.53	10,065.97				10,357.74	10,012.88
10	Earnings/(Loss) Per Share (of Rs. 2/- each) (not annualised for the quarter, in Rs.)										
Continuing Operations											
- Basic 0.98 1.00 0.84 3.52 2.88 1.41 0.24 0.70 2.78 2.61											
- Diluted 0.97 0.98 0.83 3.47 2.84 1.39 0.23 0.69 2.74 2.58											
Discontinued Operations											
- Basic (0.01) (0.01) (0.01) (0.11) (0.03) (0.01) (0.01) (0.01) (0.11) (0.03)											
- Diluted (0.01) (0.01) (0.01) (0.11) (0.03) (0.01) (0.01) (0.01) (0.11) (0.03)											
Continuing and Discontinued Operations											
- Basic 0.97 0.99 0.83 3.41 2.85 1.40 0.23 0.69 2.67 2.58											
- Diluted 0.96 0.97 0.82 3.36 2.81 1.38 0.22 0.68 2.63 2.55											

